

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળના ઉજ્જવળ ભવિષ્ય માટે સિટી ઓફ બ્રેમ્પટન શેરિડાનના નવા સેન્ટર ફોર હેલ્થી કમ્યુનિટિઝ માટે \$2.5 મિલિયનની માતબર રકમ સાથે રોકાણ કરવાનું ચાલુ રાખે છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (07 જૂન 2022) – બ્રેમ્પટનમાં સ્થાનિક આરોગ્ય સંભાળના ઉજ્જવળ ભવિષ્ય માટે સિટી ઓફ બ્રેમ્પટન રોકાણ કરવાનું ચાલુ રાખે છે જેમાં શેરિડાન કોલેજના નવા સેન્ટર ફોર હેલ્થી કમ્યુનિટિઝ માટે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે \$2.5 મિલિયનનું ભંડોળ મંજૂર કર્યું છે.

લાંબા ગાળાના રોગોથી ત્રસ્ત લોકોને વધુ સારી સંભાળ મળે તે માટે અને પીલ રિજનની તબીબી વ્યવસાયિકોની ગંભીર જરૂરિયાતને જોતા તેમાં મદદરૂપ થવા સેન્ટર ફોર હેલ્થી કમ્યુનિટિઝ આ મુજબ કરશે:

- બ્રેમ્પટનમાં નર્સો અને સંબંધિત આરોગ્ય વ્યવસાયિકોની આગામી પેઢીને બ્રેમ્પટન, પીલ અને ઓન્ટારિયોના લોકોની કાળજી લેવા માટે તાલીમ આપશે અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ કાર્યક્ષમ કાળજી માટેના સમાન વિઝનનું સમર્થન કરશે.
- વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, તબીબી વ્યવસાયિકો, ટેકનોલોજીના પ્રણેતાઓ, સમાજ સેવા પ્રદાતાઓ અને રહેવાસીઓ વચ્ચે ઈનોવેશન અને સહયોગની પ્રયોગશાળા હોય તેમ કાર્ય કરવું.
- ઈન્ટરપ્રોફેશનલ, નિવારક સંભાળ દ્વારા ક્રોનિક (દીર્ઘકાલીન) રોગના સંચાલનને સંબોધિત કરીને હોલવે આરોગ્ય સંભાળને સંબોધિત કરવામાં સહાયરૂપ થવું.
- અંદાજે 200 થી 500 નવા રોજગારના માધ્યમથી સ્થાનિક અને પ્રાદેશિક રીતે આર્થિક વિકાસને આગળ ધપાવવો જે બાંધકામ, જાળવણી, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને વહીવટ, ઔદ્યોગિક સહયોગ અને આ ક્ષેત્ર માટે પરિવહનના ઉન્નત જોડાણોથી થઈ શકશે.
- ક્લિનિકલ કિનેસિઓલોજી (પુરાવા આધારિત સંશોધનથી ઈજ અને રોગનું નિવારણ અને સારવારનું શાસ્ત્ર), નિયમનકારી બાબતો અને ક્લિનિકલ સંશોધનનાં સ્નાતક પ્રમાણપત્રોનો ઉમેરો કરીને તેમજ પ્રાદેશિક મંજૂરીને આધિન બેચેલર ઓફ નર્સિંગ એન્ડ ઓસ્ટિઓપથીના પોસ્ટગ્રેજુએટ વિકલ્પો બ્રેમ્પટનમાં વધારવા.

સિટી દ્વારા થનાર નીધિયન શેરિડાનના \$20 મિલિયનના રોકાણ ઉપરાંતનું છે અને તે બ્રેમ્પટન ખાતેના ડેવિસ કેમ્પસના નવા મકાન માટેના કન્સલ્ટેશન અને આયોજન માટે સહાયરૂપ થશે. કેટલાક નવા પ્રોગ્રામિંગ પાનખર 2022 સુધીમાં તો શરૂ પણ થઈ જશે કે જ્યારે બાકીની બાબતો મંજૂરીઓને આધિન અને નવી જગ્યાઓનો વિકાસ થતો જશે તેમ તેમ ઉપલબ્ધ થશે.

ફેર ડીલ ફોર બ્રેમ્પટન

22 જાન્યુઆરી 2020ના રોજ સીટી ઓફ બ્રેમ્પટને આરોગ્ય સંભાળની કટોકટી જાહેર કરી અને "ફેર ડીલ ફોર બ્રેમ્પટન" તરીકે

ઓળખાતી હિમાયતલક્ષી ઝુંબેશનું લોકાર્પણ કર્યું, જેમાં પ્રોવિન્સ પાસેથી વધારાના ભંડોળ માટે વિનંતી કરવામાં આવી જેથી બ્રમ્પટનની આરોગ્ય સંભાળની ત્રુટીઓના અવકાશને ભરી શકાય. બ્રમ્પટનમાં આરોગ્ય સંભાળ કટોકટીને સંબોધી શકાય અને તે સુનિશ્ચિત કરી શકાય કે આરોગ્ય સંભાળના પ્રેક્ટિશનરોની આગામી પેઢી શહેરમાં જ સ્થાનિક ધોરણે તાલીમ પામી શકે તે માટે સિટી પગલા લેવાનું ચાલુ રાખી રહ્યા છે.

ફોર ડીલ ફોર બ્રમ્પટન અભિયાન અંગે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો Brampton.ca.

હકિકતોનો ટૂંકસાર

- માર્ચ 2021માં, સિટીએ [પ્રોવિન્સ્યલ સરકારની અંદાજપત્ર અંગેની જાહેરાતને આવકારી હતી](#) જેમાં ઓસ્વર્સ પીલ મેમોરિયલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસનું એક નવા હોસ્પિટલ તરીકેના વિસ્તરણનો મુદ્દો સામેલ હતો.
- 2022ના અંદાજપત્રના ભાગ તરીકે સિટીએ [આરોગ્ય સંભાળ વિસ્તરણ માટે પોતાની પ્રતિબદ્ધતા](#) ભંડોળની \$62.5 મિલિયન જેટલી રકમ પીલ મેમોરિયલ હોસ્પિટલ માટેના સ્થાનિક હિસ્સા માટે નિયુક્ત કરેલી દર્શાવી. એપ્રિલમાં, સિટીએ આ પ્રતિબદ્ધતાને સાકાર કરવા અને આરોગ્ય કાળજીના વિસ્તરણને સહાય કરવા માટે એક ટકાની હોસ્પિટલ લેવિ વસૂલવાની મંજૂરી આપી હતી.
- માર્ચ 2022માં ઓન્ટારિયો સરકારે જાહેર કર્યું હતું કે તેઓ વધુ મજબૂત, વધુ સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ પ્રણાલિની સ્થાપના હેતુ મેડિકલ સ્કૂલના શિક્ષણનો વિસ્તાર કરશે, જેમાં સામેલ છે બ્રમ્પટનમાં સ્થિત રાયરસન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન ખુલશે ત્યારે તેને માટે 80 સ્નાતકની અને 95 અનુસ્નાતક બેઠકોનો ઉમેરો. જુલાઈ 2021માં તે વર્ષના પૂર્વાર્ધમાં, શહેરમાં ભાવિ સ્કૂલ ઓફ મેડિસિનને ભંડોળ પૂરું પાડવામાં મદદરૂપ થવા [બ્રમ્પટન સિટી કાઉન્સિલે \\$1 મિલિયનના આયોજન અનુદાનની તરફેણમાં મત પસાર કર્યો હતો](#) જેમાં સમક્ષ ભંડોળ [પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો દ્વારા રોકવામાં આવશે](#). બ્રમ્પટનમાં તબીબી સ્કૂલની સ્થાપના સિટીના ચાલુ રહેલા હિમાયતલક્ષી કાર્યનો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે અને તેનો સમાવેશ [2022 ઓન્ટારિયો પૂર્વ-અંદાજપત્ર રજૂઆતમાં](#) થયો હતો.
- એપ્રિલ 2022માં [પ્રોવિન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ \\$21 મિલિયનનું રોકાણ](#) કરવા જઈ રહ્યા છે જેથી ઓસ્વર્સ પીલ મેમોરિયલના નવા ઇનપેશન્ટ હોસ્પિટલમાં પરિવર્તન કરવાના મુદ્દાને સમર્થન આપી શકાય જેમાં 24/7 ઇમેજીન્સી ડિપાર્ટમેન્ટ હશે અને બ્રમ્પટન સિવિક હોસ્પિટલ ખાતે કેન્સર કેર સર્વિસિસનું વિસ્તરણ કરવામાં આવશે.

સુવાક્યો

“સિટી ઓફ બ્રમ્પટન આપણા શહેરની આરોગ્યસંભાળ પ્રણાલીને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે જે સ્થાનિક પ્રતિભાને ઉત્તેજન પૂરું પાડે, આર્થિક વિકાસ સાધે અને આપણા નિવાસીઓની જરૂરિયાતો પૂર્ણ થાય. શેરિડાન કોલેજના નવા સેન્ટર ફોર હેલ્થી કમ્યુનિટિઝ માટેની પ્રતિબદ્ધતાથી આપણા નિવાસીઓ માટેની આરોગ્ય સંભાળમાં તો સુધારો આવશે જ પરંતુ તે સાથે સ્થાનિક

ધોરણે ટકાઉ આર્થિક વિકાસને પણ બળ મળશે, જ્યાં નોકરીઓ અને પ્રતિભાઓ સચવાઈ જશે જેમાં ફક્ત બ્રેમ્પટન ખાતેના શેરિડાન કેમ્પસ પર જ અંદાજે 200 થી 500 કુલ ટાઈમ નોકરીઓનો સમાવેશ થાય છે.

- પૉટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"અહીં જ આ વિકાસ પામતા આપણા શહેરમાં જ બ્રેમ્પટનવાસીઓ વિશ્વ સ્તરની આરોગ્ય સંભાળ અને શિક્ષણ પામી શકે તે યોગ્ય જ છે. શેરિડાન કોલેજના એરિયા રિજનલ કાઉન્સિલર તરીકે મને આરોકાણને સમર્થન આપતા અત્યંત આનંદ થયો કે તેનાથી સારી ગુણવત્તાનું પોસ્ટ સેકન્ડરી શિક્ષણ મળી શકશે જેથી આપણા નિયોક્તાઓને એવી પ્રતિભાઓ સુલભ બની શકે જેની તેમને જરૂર છે અને સાથે જ સમાજની આરોગ્ય સંભાળની જરૂરિયાત પણ સંતોષી શકાશે."

માર્ટિન મેડિરોસ (Martin Medeiros) રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, સીટી ઓફ બ્રેમ્પટન

બ્રેમ્પટન સૌથી વધુ ઝડપથી વિકસતા અત્યંત બહુમુખી અને યુવા સમુદાયો પૈકી એક છે અને અવસરોથી ઉભરાતા શહેર તરીકે અમે અમારા રહેવાસીઓ માટેની પોસ્ટસેકન્ડરી તકો વિસ્તારવા સમર્પિત છીએ અને ભાવિ આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે તૈયાર છીએ. શેરિડાન કોલેજના નવા સેન્ટર ફોર હેલ્થી કમ્યુનિટિઝમાં થયેલ રોકાણથી બ્રેમ્પટનની તબીબી વ્યવસાયિકોની જરૂરિયાત સંતોષાશે અને નિવાસીઓને સ્થાનિક શૈક્ષણિક અવસરો મળી શકશે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

"જ્યારે ક્રોનિક (દીર્ઘકાલીન) રોગો વિશે વાત કરીએ છીએ ત્યારે ખાસ કરીને સમુદાયની નિર્ણાયક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે બ્રામ્પટનમાં પોસ્ટસેકન્ડરી વિકલ્પો વધારવા માટે રોમાંચિત છીએ. પીલના અડધા જેટલા નિવાસીઓમાં ઓછામાં ઓછા એક ક્રોનિક રોગ હોવાનું નિદાન થયું છે અને 73 ટકા જેટલી બ્રેમ્પટનની વસ્તી દેખીતી રીતે લઘુમતિની છે અને તેમને સાંસ્કૃતિક રીતે સમર્થ સંભાળ સુલભ નથી. આ સમાજને સેન્ટર ફોર ક્રોનિક ડિઝિઝ મેનેજમેન્ટની જરૂર છે જે આ પરિયોજનાનો ભાગ બનશે જેથી ડાયાબિટીસ, કાર્ડિયોવસ્ક્યુલર વ્યાધિ અને અન્ય ક્રોનિક રોગો ભોગવતા લોકો માટે નિર્ણાયક નિવારણ અને વ્યવસ્થાપનની જરૂરિયાતોને પહોંચી વળાય, જેનાથી લોકોને ઈમર્જન્સી રૂમમાં દાખલ થવું પડતું હોય છે. બ્રેમ્પટનમાં ઓછામાં ઓછી 700 નવી પોસ્ટ સેકન્ડરી આરોગ્ય સંભાળની બેઠકો પૂરી પાડીને અમે પીલ રિજનમાં સ્થાનિક, ઉચ્ચ તાલીમ પામેલ આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને રાખવામાં સહયોગ કરી રહ્યા છીએ."

- જેનેટ મોરિસન, પ્રમુખ અને ઉપ-કુલપતી, શેરિડાન કોલેજ

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca